

DD-103
December-2013
B.Sc. Sem. I
Core Course – 1 : PHYSICS
Paper : 101

Time : 3 Hours]**[Max. Marks : 50]**

સૂચના : (1) દરેક પ્રશ્નના ગુણ સમાન છે.

Instructions : All questions carry equal marks.

(2) સંજ્ઞાઓ તેમના પ્રચલિત અર્થ ધરાવે છે.
Symbols have their usual meaning.

1. (a) સાબિત કરો કે, $\vec{A} \times (\vec{B} \times \vec{C}) = \vec{B}(\vec{A} \cdot \vec{C}) - \vec{C}(\vec{A} \cdot \vec{B})$ તે પરથી 6

$$\text{દર્શાવો કે, } \vec{A} \times (\vec{B} \times \vec{C}) + \vec{B} \times (\vec{C} \times \vec{A}) + \vec{C} \times (\vec{A} \times \vec{B}) = 0$$

Prove that, $\vec{A} \times (\vec{B} \times \vec{C}) = \vec{B}(\vec{A} \cdot \vec{C}) - \vec{C}(\vec{A} \cdot \vec{B})$ and

show that, $\vec{A} \times (\vec{B} \times \vec{C}) + \vec{B} \times (\vec{C} \times \vec{A}) + \vec{C} \times (\vec{A} \times \vec{B}) = 0$

અથવા/OR

અદિશ ક્ષેત્ર માટે ગ્રેડિયન્ટ મેળવો.

Derive gradient of scalar field.

- (b) અદિશ \vec{A} માટે સમતલ ધ્રુવીય ધામ પદ્ધતિમાં $\frac{d\vec{A}}{dt}$ મેળવો. 4

Obtain $\frac{d\vec{A}}{dt}$ for vector \vec{A} in plane polar co-ordinate system.

અથવા/OR

$\vec{V} = xz^2 \hat{i} + 2xy_z^2 \hat{j} + 2yz^3 \hat{k}$, માટે $\text{curl } \vec{V}$ નિઃદ્ધ (1,1,1) પાસે મેળવો.

If $\vec{V} = xz^2 \hat{i} + 2xy_z^2 \hat{j} + 2yz^3 \hat{k}$, then find $\text{curl } \vec{V}$ at point (1, 1, 1).

2. (a) સાધિયામાં પ્રસરતા સંગત તરંગ માટે વિકલ સમીકરણ મેળવો અને $v = \sqrt{\frac{E}{\rho}}$ મેળવો. 6

Drive differential equation of longitudinal wave propagating through rod and obtain $v = \sqrt{\frac{E}{\rho}}$.

અથવા/OR

અલ્ટ્રાસોનિક તરંગોના ઉત્પાદન માટેની મેળેટોસ્ટ્રીક્શન રીત વર્ણવો.

Describe principle of magnetostriction method to produce ultrasonic waves.

- (b) દૂંકનોંધ લખો : ધ્વનિ તીવ્રતાનું લેવલ-પ્રબળતા.

4

Write a note on level of intensity of sound-Loudness.

અથવા/OR

અલ્ટ્રાસોનિક તરંગોના ડિટેક્શન માટેની રીત વર્ણવો.

State and describe method of detection of ultrasonic waves.

3. (a) ન્યૂટનના વલયોની થીયરી વર્ણવો અને પથ તફાવત માટેનું સૂત્ર મેળવો અને પ્રકાશિત તેમજ અપ્રકાશિત વલયો માટેની શરત લખો.

6

Explain theory of Newton's ring and obtain the expression for path difference and write conditions for bright and dark fringes.

અથવા/OR

વકીભવન માટેનો શ્રેષ્ઠિક મેળવો.

Obtain matrix for refraction.

- (b) ફર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વકીભવન માટે જોલનો નિયમ મેળવો.

4

Obtain Snell's law of retraction using Farmat's principle.

અથવા/OR

$$\text{શ્રેષ્ઠિક, } A = \begin{bmatrix} 2 & 3 & 1 \\ 1 & 2 & 3 \\ 3 & 1 & 2 \end{bmatrix} \text{ માટે વ્યસ્ત શ્રેષ્ઠિક મેળવો.}$$

$$\text{Find inverse of the matrix } A = \begin{bmatrix} 2 & 3 & 1 \\ 1 & 2 & 3 \\ 3 & 1 & 2 \end{bmatrix}$$

4. (a) LASER લેસરના ઉપયોગો લખો.

6

Write applications of LASER.

અથવા/OR

આઈનસ્ટાઈનના સદ્ગુણકો A અને B મેળવો.

Derive Einstein's co-efficient A and B.

- (b) લેસર પ્રકાશ-દ્રવ્ય અંતરક્ષિયા માટે પ્રકાશિય શોખણા લંબાઈ માટેનું સૂત્ર મેળવો અને પ્રસારણ લંબાઈનું સૂત્ર લખો.

4

For Laser light-matter interaction, derive equation of optical absorption length and give equation of diffusion length.

અથવા/OR

$9 \times 10^{-7} \text{ m}$ તરંગ લંબાઈવાળું એક લેસર બીમ 4 mm વાસવાળા કાણમાંથી બહાર આવે છે. આ બીમ ચંદ્ર પર મોકલવામાં આવે છે તો, (1) બીમનું કોણીય વિસ્તરણ (2) ચંદ્ર પર રચાત્તા ટપકાનો વ્યાસ શોધો. પૃથ્વીથી ચંદ્રનું અંતર = $4 \times 10^5 \text{ km}$ છે.

A LASER beam of wavelength $9 \times 10^{-7} \text{ m}$ comes from the aperture of diameter 4 mm. The beam is sent to Moon. Calculate : (1) angular spread of beam, (2) diameter of spot on moon, Distance between Earth and Moon = $4 \times 10^5 \text{ km}$.

5. નીચેના પ્રશ્નોના અતિ ટૂકા જવાબ આપો : (દરેક પ્રશ્નનો ગુણ 1 હૈ.)

10

Give answers of following questions in short : (Each is of 1 mark.)

(1) સ્ટોકના પ્રમેયનું કથન લખો.

State Stoke's theorem.

(2) ગૌસના પ્રમેયનું કથન લખો.

State Gauss's theorem.

(3) સદિશ ક્ષેત્રની વ્યાખ્યા આપો.

Define vector field.

(4) હાર્મોનિક તરંગો એટલે શું ?

What are harmonic waves ?

(5) હાઈ પીચ ધ્વનિ વ્યાખ્યાયિત કરો.

Define high pitch sound.

(6) SONAR એટલે શું ?

What is SONAR ?

(7) ફર્માટનો સિદ્ધાંત લખો.

Write Farhat's principle.

(8) વ્યતિકરણ એટલે શું ?

What is interference ?

(9) LASER નું પૂર્ણ નામ લખો.

Give full form of LASER.

(10) LIDAR નું પૂર્ણ નામ લખો.

Give full form of LIDAR.
